

LL.B. Semester - 3 (CBCS) Examination
Nov/Dec-2023 [NEW COURSE]
Principles of Taxation Law & GST(Core)

Time: 3:00 Hours

Marks: 100

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ વ્યક્તિના રહેણાંકના દરજ્જા સંબંધી આવકવેરાના કાયદાની જોગવાઈઓ સમજાવો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૧ આવકવેરાના કાયદા હેઠળ મૂડી નફાની જોગવાઈઓ વર્ણવો.
- પ્રશ્ન-૨ પગારની આવકમાં કઈ-કઈ આવકનો સમાવેશ થાય છે અને બાદ મળે છે. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૨ આવકવેરા કાયદા નીચે અપીલની જોગવાઈઓ ટૂંકમાં સમજાવો.
- પ્રશ્ન-૩ આવકવેરા અન્વયે જડતી અને જપ્તી ટૂંકમાં વર્ણવો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૩ માલ અને સેવા કર અધિનિયમ નીચે “વેરા લેવા અને વસુલ કરવા” અંગે સમજાવો.
- પ્રશ્ન-૪ મકાન મિલકતની આવક ગણતી વખતે કઈ કઈ રકમો મળે છે-ચર્ચા કરો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૪ માલ અને સેવા કર અધિનિયમ નીચે નોંધણી વિગતવાર સમજાવો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૨૦)
- 1) આવકવેરા કાયદા નીચે મૂળમાંથી કપાત
 - 2) માલ અને સેવા કર અધિનિયમ નીચે જમાનોંધ-ઉધારનોંધ
 - 3) ખેતીની આવક
 - 4) ઈ-કોમર્સ ઓપરેટર

ENGLISH VERSION

- Que-1 Explain the provisions regarding residential status of a person under the Income Tax Act. (20)
 OR
- Que-1 Describe the provisions of capital gain under Income Tax Act.
- Que-2 Which income are included and exempted from the income of salary. (20)
 OR
- Que-2 Explain in brief the appellate provisions under Income Tax Act.
- Que-3 Explain in brief, the search and seizure under Income Tax Act. (20)
 OR
- Que-3 “Cover the tax and recover the tax” explain under Goods and Service Tax.
- Que-4 Discuss in the enumerate deductions allowable while calculating income from house property. (20)
 OR
- Que-4 Explain “Registration” under Goods and Service Tax.
- Que-5 Write Short Notes: (Any Two) (20)
- 1) Tax deduction at source(TDS) under Income Tax Act
 - 2) “Credit Note” and “Debit Note” under GST Act
 - 3) Income of Agriculture
 - 4) E-Commerce Operator
